

B.Ed. Semester - 2 (CBCS) Examination
August/September -2020 [OLD COURSE]
ELEMENTS OF ACCOUNT (SELF STUDY COURSE)

Time: 1:00 Hours

Marks: 28

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (06)
1. સિદ્ધાંતની ભૂલ એટલે શું?
 2. ખતવણી અંગેની ભૂલ એટલે શું ?
 3. હૂંડીની વ્યાખ્યા આપો.
 4. ઘસારાનો અર્થ આપો.
- પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર ના જવાબ આપો. (12)
1. ઘસારાની જોગવાઈની જરૂરિયાત જણાવો.
 2. હિસાબી ભૂલોના પ્રકારોનો ચાર્ટ તૈયાર કરો.
 3. જોગવાઈનો અર્થ મહત્વ જણાવો.
 4. સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચે તફાવત આપો.
 5. વેપાર ખાતાનો નમૂનો આપો.
- પ્રશ્ન.૩ નીચેનામાંથી કોઈ પણ બેના ઉત્તર આપો. (10)
1. કાચા સરવૈયા અને પાકા સરવૈયા વચ્ચે તફાવત આપો.
 2. હિસાબો તૈયાર કરવાની પ્રણાલિકાગત પદ્ધતિ અને કમ્પ્યુટર આધારિત હિસાબી પદ્ધતિ વચ્ચે તફાવત આપો.
 3. અનામત અને જોગવાઈ વચ્ચે તફાવત આપો.
 4. દેશી નામા પદ્ધતિ અને દ્વીનોંધી નામા પદ્ધતી વચ્ચે તફાવત આપો.
 5. પાકા સરવૈયાનો નમૂનો આપો.

ENGLISH VERSION

- Q.1 Answer the following questions: (Any Three) (06)
1. What is Error of Principle?
 2. What is Errors of posting?
 3. Give definition of Bills of exchange.
 4. Give meaning of depreciation.
- Q.2 Answer the following questions: (Any Four) (12)
1. Mention necessity of provision for depreciation.
 2. Prepare a chart of types of error.
 3. Give meaning and importance of provision.
 4. Give difference between general reserve and capital reserve.
 5. Give specimen of trading account.
- Q.3 Answer the following questions: (Any Two) (10)
1. Give difference between trail balance and balance sheet.
 2. Give difference between conventional accounting and computer accounting method.
 3. Give difference between reserve and provision.
 4. Give difference between deshi accounting system and double entry system.
 5. Give specimen of balance sheet.
